

**માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના**  
**(પ્રથમ રિન્યુઅલ વર્ષ-૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯**

**બીજું રિન્યુઅલ વર્ષ ૨૦૧૭-૧૮)**

**ઠરાવ ક્રમાંક: ૫૨૪/૧૦૨૦૧૪/UOR-૬/ખ**

1. ઉક્ત ઠરાવમાં દર્શાવેલ કોઈ-પણ એક કે વધુ ગ્રુપમાં આવતા વિદ્યાર્થીઓ માટે “માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના”માં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વિગતો આ સાથે સામેલ છે.
2. આ યોજના માટે વિદ્યાર્થીએ વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ તથા પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ હોવી જોઈએ.
3. વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યા ત્યાર પછીના ક્રમિક શૈક્ષણિક વર્ષમાં રિન્યુઅલ શિષ્યવૃત્તિ મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે અને જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા ૭૫% હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. ([ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે](#))
4. આ યોજના માટે જે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૭-૧૮ માટેની સહાય મેળવેલ હોય તેઓએ પ્રથમ રિન્યુઅલ અને બીજા રિન્યુઅલ બંને માટે અરજી કરવાની રહેશે. સૌપ્રથમ પ્રથમ રિન્યુઅલમાં માટે ઓનલાઈન અરજી કરી હેલ્પ-સેન્ટર ખાતે વેરીફાઈ કરવાની રહેશે. પ્રથમ રિન્યુઅલની અરજી હેલ્પ-સેન્ટર ખાતે વેરીફાઈ થયા બાદ જ બીજા રિન્યુઅલની અરજી કરી શકશે.
5. વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ <https://scholarships.gujarat.gov.in/> પર રજીસ્ટ્રેશન કરી ભરવાનું રહેશે.
6. રજીસ્ટ્રેશન કરતા પહેલા વિદ્યાર્થીએ નોટીસ બોર્ડ પર આપેલી બધી વિગતો જેતે લાઇન પર ક્લીક કરી વાંચી લેવી તથા ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું.
7. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે <https://scholarships.gujarat.gov.in/> વેબસાઈટ પર લોગ-ઇન થવાનું રહેશે.
8. રિન્યુઅલ અરજી માટે રજીસ્ટર થયેલા મોબાઇલ નંબર પર Password આવેલ હશે જેના વડે વિદ્યાર્થીએ લોગ ઇન થવાનું રહેશે. (વિદ્યાર્થીએ મોબાઇલ નંબર પોતાનો જ આપવો, અને સમગ્ર અભ્યાસક્રમનાં સમયગાળા દરમિયાન બદલવો નહીં, ભવિષ્યમાં એજ નંબર પર SMS દ્વારા માહિતી મોકલવામાં આવશે).
9. લોગ ઇન થયા પછી માંગવામાં આવેલ વિગતો ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીઓએ પોતાના ઓરીજનલ દસ્તાવેજ સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેશે. અપલોડ કરવાના તમામ દસ્તાવેજો .jpg /.jpeg/.pdf ફોર્મેટમાં હોવા જોઈએ અને દરેક દસ્તાવેજ મહત્તમ 500 kb સાઈઝની હોવી જોઈએ.

10. પ્રથમ રિન્યુઅલ ૨૦૧૭-૧૮ માટે અરજી કરતા વિદ્યાર્થીએ વાલીની આવકનું પ્રમાણપત્ર [નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮](#)નું, બીજા રિન્યુઅલ ૨૦૧૭-૧૮ માટે અરજી કરતા વિદ્યાર્થીએ વાલીની આવકનું પ્રમાણપત્ર [નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯](#)નું અને પ્રથમ રિન્યુઅલ ૨૦૧૮-૧૯ માટે અરજી કરતા વિદ્યાર્થીએ વાલીની આવકનું પ્રમાણપત્ર [નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯](#)નું આવકનું પ્રમાણપત્ર મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. વિદ્યાર્થીએ આપવાના સેલ્ફ ડેકલેરેશનમાં વાલી (માતા-પિતા)ની આવકની વિગતો આપવાની રહેશે.
  11. પ્રથમ રિન્યુઅલ ૨૦૧૭-૧૮ માટે અરજી કરતા વિદ્યાર્થીએ વાલીની આવકનું [નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮](#), બીજા રિન્યુઅલ ૨૦૧૭-૧૮ માટે અરજી કરતા વિદ્યાર્થીએ વાલીની આવકનું [નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯](#) અને પ્રથમ રિન્યુઅલ ૨૦૧૮-૧૯ માટે અરજી કરતા વિદ્યાર્થીએ [નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯](#)નું ઇન્કમેટેક્સ રિટર્ન અથવા ઇન્કમેટેક્સ રિટર્ન ન ભરેલ હોય તેઓએ “ આવકવેરાને પાત્ર આવક નથી હોવાનું સેલ્ફ ડીકલેરેશન” આપવાનું રહેશે. ([ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે](#))
  12. [જે વાલીઓની](#) નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ની આવક રૂ. ૨.૫૦ લાખથી વધારે હશે તેમને ફરજિયાત ઇન્કમેટેક્સ રિટર્ન જોડવાનું રહેશે.
  13. વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરતા હોય તે સંસ્થાના આચાર્યશ્રી પાસેથી સંસ્થાના લેટરહેડ પર રીન્યુઅલનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે .
  14. સેલ્ફ ડેકલેરેશન, સંસ્થાના આચાર્યશ્રી પાસેથી મેળવવાનું પ્રમાણપત્ર તથા આવકના પ્રમાણપત્રનું ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  15. મંજૂર થયેલ મળવાપાત્ર સહાયની રકમ વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) હેઠળ સીધી જમા થતી હોવાથી વિદ્યાર્થીએ નેશનલાઈઝ્ડ બેન્કમાં ખાતું ખોલાવવાનું રહેશે અને આ બેન્ક ખાતા સાથે વિદ્યાર્થીએ પોતાનો આધાર નંબર જોડવાનો (seeding) રહેશે .[વિદ્યાર્થીએ પોતાના આધારનંબરની વિગત ઓનલાઈન અરજીમાં આપવાની રહેશે.](#)
  16. વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીપત્રની પ્રિન્ટઆઉટ લઈ રાજ્યભરમાં આવેલ ૧૭૬ હેલ્પ સેન્ટરો પૈકી પોતાના અભ્યાસક્રમને સંબંધિત નજીકના હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે અને અરજી સાથે નીચે જણાવેલ સ્વપ્રમાણિત દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.  
[Acknowledgement Receipt](#) મેળવવાની રહેશે.
- વિદ્યાર્થીના પ્રથમ વર્ષની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)
  - ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વપ્રમાણિત નકલ (અસલમાં)
  - વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું) સ્વપ્રમાણિત નકલ,

- સંસ્થાના આચાર્યશ્રીનું સંસ્થાના લેટરહેડ પર રિન્યુઅલનું પ્રમાણપત્ર (અસલમાં),
  - નેશનલાઈઝ્ડ બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ/કેન્સલડ ચેક
  - ઇન્કમેટેક્સ રીટર્નની સ્વ-પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં).
- વિદ્યાર્થીએ જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી કરી છે, તેનાં પ્રમાણપત્રની નકલ તેમણે રજુ કરવાની રહેશે તેની યાદી નીચે મુજબ છે. (વિદ્યાર્થીને લાગુ પડતા પ્રમાણપત્રો જ રજુ કરવાના રહેશે.)
    - a) શ્રમિક કાર્ડ (ચાલુ વર્ષનું)
    - b) સૈનિક વેલફેર બોર્ડનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
    - c) વિકલાંગતાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર(ચાલુ વર્ષનું)
    - d) જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
    - e) માતા પિતા અલગ થયાના પુરાવા (કોર્ટનો ચુકાદો)
    - f) માતા/પિતાનું મરણનું પ્રમાણપત્ર
    - g) અનાથ આશ્રમનું પ્રમાણપત્ર
    - h) વિધવા હોવાનું પ્રમાણપત્ર (ચાલુ વર્ષનું)
    - i) ત્યકતા હોવાનું રૂ.૧૦૦ના સ્ટેમ પેપર પર એફિડેવિટ (ચાલુ વર્ષનું)
17. તબીબી અભ્યાસક્રમમાં માત્ર MBSS અભ્યાસક્રમ જ અને અન્ય તમામ અભ્યાસક્રમ જેવા કે ડેન્ટલ , નર્સિંગ ,ફિઝિયોથેરેપી ,આયુર્વેદ વગેરેનો સમાવેશ પેરામેડીકલમાં અભ્યાસક્રમમાં કરવામાં આવશે.
18. પેરામેડીકલ ,તબીબી ,ઈજનેરી વગેરેમાં સ્વનિર્ભર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારને જ ટ્યુશન ફીના ૫૦% અથવા મહત્તમ મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
- 19. વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યાના ૧૫ દિવસમાં સંબંધિત અભ્યાસક્રમના નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઈ દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે .**
20. જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષે શરતચૂકથી અરજી ન કરી શક્યા હોય અને બીજા વર્ષે અરજી કરવા માંગતા હોય એ વિદ્યાર્થીઓએ સબ્જેક્ટમાં “Delayed student” લખીને [cmsskcg2019@gmail.com](mailto:cmsskcg2019@gmail.com) પર ઈ-મેઈલ કરવાનો રહેશે.
21. યોજનાની વધુ માહિતી હેલ્પ લાઈન નં.૦૭૯-૨૬૫૬૬૦૦૦, ૭૦૪૩૩૩૩૧૮૧(૧૦:૩૦ થી ૧૮:૦૦ દરમ્યાન) પરથી મળી શકશે અને [cmsskcg2019@gmail.com](mailto:cmsskcg2019@gmail.com) પરથી મળી રહેશે.